

ત્વરિત જાહેરાત માટે

## દરેક ડોર પાછળની વાર્તા શોધો - ડિજિટલ!

બ્રમ્પટન, ઓન્ટેરિયો (સપ્ટેમ્બર 21, 2020) – શનિવાર, સપ્ટેમ્બર 26 થી શનિવાર, ઓક્ટોબર 31 સુધી, રહેવાસીઓ અને મુલાકાતીઓ બ્રમ્પટનનો ઇતિહાસ, વારસો ધરાવતા અને અજોડ સાંસ્કૃતિક સ્થળોનો અનુભવ પોતાના ઘરની સગવડમાંથી, ડિજિટલ ડોર્સ ઓપન (Doors Open) ના ભાગ તરીકે ઓનલાઇન કરી શકે છે.

સીટી ઓફ બ્રમ્પટને સમગ્ર પ્રોવિન્સના ભાગ તરીકે, હવે મહિનાભરના આયોજન તરીકે 20 થી વધારે ઐતિહાસિક અને વારસો ધરાવતા સ્થળો અને આપણાં સમુદાયમાં રસપ્રદ સ્થળોની ટૂર્સ, વીડિયો અને ફોટા સાથે આ વર્ષના લંબાવેલા ડોર્સ ઓપન (Doors Open) માટે ઓનલાઇન હબ બનાવ્યું છે. આ વર્ષે નવું, બ્રમ્પટન આર્ટિસ્ટ્સ ઓનલાઇનથી આપણાં સમુદાયમાં જાહેર કળા વિશે શીખો, અને ભૂતિયા અને વારસો સંબંધિત પર્યટન ઓનલાઇન જોઈને માણો.

બ્રમ્પટનમાં દરેક પાડોશ પાસે કહેવા જેવી એક વાર્તા છે. આપણાં શહેરના જાહેર કળા સ્મારકો શોધો, આપણી ફાયર અને ટ્રાન્ઝિટ સગવડો વિશે શીખો, અને એલ્ડરલી એસ્ટેટ, ગ્રેસ યુનાઈટેડ ચર્ચ અને ઐતિહાસિક બોર્ડા હાઉસ સહિતની આપણાં સમુદાયની પૂર્વકાલીન ઇમારતોનો પ્રવાસ ખેડો. જાહેર જનતા માટે દરરોજ ન ખુલતા વિસ્તારોમાં અનોખી, દૃશ્ય પાછળ પહોંચ મેળવીને, આપણાં સમુદાયમાં અગાઉ ક્યારેય ના જોયા હોય તેવા સ્થળો જુઓ.

સંપૂર્ણ અનુભવ માટે વેબસાઈટ જુઓ, [brampton.ca/doorsopen](http://brampton.ca/doorsopen).

ઓન્ટેરિયો હેરિટેજ ટ્રસ્ટ ડોર્સ ઓપન (Doors Open) ઓન્ટેરિયો માટે પોતાના સૌથી અજોડ અને રોમાંચક સાંસ્કૃતિક સ્થળોના ડિજિટલ ડોર્સ, ગેટ્સ અને કોર્ટયાર્ડ્સ ખોલવા સમગ્ર ઓન્ટેરિયોના સમુદાયો સાથે કામ કરી રહ્યું છે, જેથી તમે ઇતિહાસ અને આંતરિક વાર્તાઓની શોધખોળ કરી શકો છો.

વધુ માહિતી મેળવવા વેબસાઈટ જુઓ, [doorsopenontario.on.ca](http://doorsopenontario.on.ca).

### અવતરણો (ક્વોટ્સ):

“આ વર્ષે, દરેક વ્યક્તિને બ્રમ્પટનમાં ઘણાં અજોડ ડોર્સ પાછળની વાર્તા શોધવાની વિસ્તારેલી તક આપીને, ડોર્સ ઓપન (Doors Open) આખો મહિનો ઓનલાઇન યોજાશે. બ્રમ્પટન સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ ધરાવે છે, અને હું તમને તમારા ઘરે બેઠા સગવડમય અનુભવીને અગાઉ ક્યારેય ના જોયા હોય તેવા આપણાં સૌથી અજોડ અને મનોહર દૃશ્યો ખોળવા પ્રોત્સાહિત કરું છું.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રમ્પટન

“ડોર્સ ઓપન (Doors Open) આ વર્ષે થોડુંક જુદું લાગી શકે, પણ તેના જેવો બીજો કોઈ અનુભવ નહિ થાય. બ્રમ્પટનના કેટલાક સૌથી રસપ્રદ સ્થળોની ટૂર્સ, વીડિયો અને ફોટા, અને આખો મહિનો કલાકારોની વાર્તા અને ભૂતિયા અને વારસો ધરાવતા પ્રવાસોની તપાસ કરવા અમારા ઓનલાઇન હબની મુલાકાત ચોક્કસપણે લેશો.”

- પૉલ વિસેંટે (Paul Vicente), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 1 અને 5, ઉપાધ્યક્ષ, આર્થિક વિકાસ અને સંસ્કૃતિ, સીટી ઓફ બ્રમ્પટન

“સીટી કર્મચારીઓએ આ વર્ષના ડિજિટલ ડોર્સ ઓપન (Doors Open) બ્રેમ્પટન આયોજન માટે એક ઉત્કૃષ્ટ ઓનલાઇન હબ બનાવ્યું છે, જે આપણાં શહેરના ઈતિહાસ, વારસો ધરાવતા અને અજોડ સાંસ્કૃતિક સ્થળો ઉજવવા આકર્ષક દૃશ્યોથી ભરપૂર છે. આ એ આયોજન છે જેને તમે ચૂકવાનું ઈચ્છશો નહીં!”

- ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે [www.brampton.ca](http://www.brampton.ca).

**મિડિયા સંપર્ક :**

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)